

## તમારા હાડકાની સંભાળ લેતા રહેશો તો તે તમને સંભાળશો

ગાંધીનગર, તા. ૨૦ અન્તંત જરૂરી બને છે. નિયમિત કસરત, સૂર્યપ્રકાશ, કમજીલી તે તરીકે ઉજવવામાં આવે છે. માનવીના પ્રોફેન્યુનું આધાર કેલ્લોઝ વધુ માનવીમાં મળી રહે છે એટમિનિસ્ટ્રેશનના રલ વિદ્યાર્થીઓનું વાયા સુધી ઈન્ટરન્શીપ ટાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગ દરમાન કાલુપુર કોમર્શિયલ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે તાલીમ દરર્યાન બેન્કના એજલેયમ શ્રી અરીલ શ્રીમાણીએ વિદ્યાર્થીઓને અમદાવાદ સ્થિત ગ્રાઉન્ડિન રોડ, બાપુનગર, સાયન્સસ્ટીટી, સ્વસ્થિક બેન્કમાંથી બેવડ વળી જતું, છે. જેમ કે ફેફાર, કરમાંથી બેવડ વળી જતું, છે. જેણી માનવી સ્વસ્થ ઘડપણ પ્રકૃતીલાલ છુવન જીવન થાકે. માટે દરેક માનવીએ પોતાના શરીરના ડિમ્સની અંગ હાડકાની માવજત કરવી જોઈએ.

મુખ્યના શરીરમાં હાડકા અગત્યનો ભાગ છે. શરીરના હલન ચલન, સાંધા, તેમજ શરીરના અંગોના રક્ષણ માટે હાડકા મજબૂત હોવા અનુર્ધા હે. શરીરમાં ૧૮ વર્ષ સુધી હાડકાની માવજત વૃદ્ધિ થયે છે. પરંતુ રૂપ વર્ષ બાદ હાડકા નબળા પડે અત્યારના સમેયે અન્તંત જરૂરી બની છે. ત્યારે હાડકા મજબૂત બની રહે તે માટે આપણે યોગ આધાર તેમજ ઝડપથી થયે છે. હાડકાને કમજોર થયા અટકવાના કસરત કરીને શરીરના અંગોની માવજત કરવી આપણે માટે યોગ આધાર, પ્રોટીન, કેલ્લોઝ, ફોર્કરસ,

**સ્વસ્થ ઘડપણ  
અને પ્રકૃતિલાલ  
જીવન માટે  
હાડકાની માવજત  
જરૂરી છે**

મનુષ્યના સૌથી અગત્યના અંગ હાડકાની માવજત વૃદ્ધિ થયે છે. પરંતુ રૂપ વર્ષ બાદ હાડકા નબળા પડે અત્યારના સમેયે અન્તંત જરૂરી બની છે. ત્યારે હાડકા મજબૂત બની રહે તે માટે આપણે યોગ આધાર તેમજ ઝડપથી થયે છે. હાડકાને કમજોર થયા અટકવાના કસરત કરીને શરીરના અંગોની માવજત કરવી આપણે માટે યોગ આધાર, પ્રોટીન, કેલ્લોઝ, ફોર્કરસ,

## બીબીએ કોલેજના વિદ્યાર્થીઓનું કાલુપુર બેંકમાં ઈન્ટરન્શીપ પ્લેસમેન્ટ

ગાંધીનગર, તા. ૨૦ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અલગ કુલ ૮ બાંચમાં તેઓનું વિમિટેડની રિઝાઓનલ ઓફિસ ઈન્ટરન્શીપ પ્લેસમેન્ટ કરવામાં સંલગ્ન હો. કોલેજ ઓફ બિઝિન્સ અમદાવાદ ખાતે બોર્ડે રીપી આવ્યું હતું. વિદ્યાર્થીઓને ૩૦ દિવસની એટમિનિસ્ટ્રેશનના ૨૮ વિદ્યાર્થીઓનું કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે તાલીમ દરર્યાન બેન્કના એજલેયમ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે શરીરમાં આવ્યું હતું. ટ્રેનિંગ દરમાન કાલુપુર કોમર્શિયલ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે શરીરમાં આવ્યું હતું. બીબીએ ને અવગાણીએ છી. હાડકાની અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શરીરમાં હાડકા પંચાવના સાઈટ વર્ષ પછી હાડકા મજબૂત રહે તે નબળા પડે તેના વિક્રી અલગ અલગ સ્વરૂપે દેખાય છે. જેમ કે ફેફાર, કરમાંથી બેવડ વળી જતું, છે. જેણી માનવી સ્વસ્થ ઘડપણ પ્રકૃતીલાલ છુવન થાકે. માટે દરેક માનવીએ પોતાના શરીરના ડિમ્સની અંગ હાડકાની માવજત કરવી જોઈએ.

ગાંધીનગર, તા. ૨૦ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અલગ કુલ ૮ બાંચમાં તેઓનું વિમિટેડની રિઝાઓનલ ઓફિસ ઈન્ટરન્શીપ પ્લેસમેન્ટ કરવામાં સંલગ્ન હો. કોલેજ ઓફ બિઝિન્સ અને એટમિનિસ્ટ્રેશનના ૨૮ વિદ્યાર્થીઓનું કાલુપુર કોમર્શિયલ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે તાલીમ દરર્યાન બેન્કના એજલેયમ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે શરીરમાં આવ્યું હતું. બીબીએ ને અવગાણીએ છી. હાડકાની અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શરીરમાં હાડકા પંચાવના સાઈટ વર્ષ પછી હાડકા મજબૂત રહે તે નબળા પડે તેના વિક્રી અલગ અલગ સ્વરૂપે દેખાય છે. જેમ કે ફેફાર, કરમાંથી બેવડ વળી જતું, છે. જેણી માનવી સ્વસ્થ ઘડપણ પ્રકૃતીલાલ છુવન થાકે. માટે દરેક માનવીએ પોતાના શરીરના ડિમ્સની અંગ હાડકાની માવજત કરવી જોઈએ.

ગાંધીનગર, તા. ૨૦ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અલગ કુલ ૮ બાંચમાં તેઓનું વિમિટેડની રિઝાઓનલ ઓફિસ ઈન્ટરન્શીપ પ્લેસમેન્ટ કરવામાં સંલગ્ન હો. કોલેજ ઓફ બિઝિન્સ અને એટમિનિસ્ટ્રેશનના ૨૮ વિદ્યાર્થીઓનું કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે તાલીમ દરર્યાન બેન્કના એજલેયમ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે શરીરમાં આવ્યું હતું. બીબીએ ને અવગાણીએ છી. હાડકાની અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શરીરમાં હાડકા પંચાવના સાઈટ વર્ષ પછી હાડકા મજબૂત રહે તે નબળા પડે તેના વિક્રી અલગ અલગ સ્વરૂપે દેખાય છે. જેમ કે ફેફાર, કરમાંથી બેવડ વળી જતું, છે. જેણી માનવી સ્વસ્થ ઘડપણ પ્રકૃતીલાલ છુવન થાકે. માટે દરેક માનવીએ પોતાના શરીરના ડિમ્સની અંગ હાડકાની માવજત કરવી જોઈએ.

ગાંધીનગર, તા. ૨૦ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અલગ કુલ ૮ બાંચમાં તેઓનું વિમિટેડની રિઝાઓનલ ઓફિસ ઈન્ટરન્શીપ પ્લેસમેન્ટ કરવામાં સંલગ્ન હો. કોલેજ ઓફ બિઝિન્સ અને એટમિનિસ્ટ્રેશનના ૨૮ વિદ્યાર્થીઓનું કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે તાલીમ દરર્યાન બેન્કના એજલેયમ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે શરીરમાં આવ્યું હતું. બીબીએ ને અવગાણીએ છી. હાડકાની અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શરીરમાં હાડકા પંચાવના સાઈટ વર્ષ પછી હાડકા મજબૂત રહે તે નબળા પડે તેના વિક્રી અલગ અલગ સ્વરૂપે દેખાય છે. જેમ કે ફેફાર, કરમાંથી બેવડ વળી જતું, છે. જેણી માનવી સ્વસ્થ ઘડપણ પ્રકૃતીલાલ છુવન થાકે. માટે દરેક માનવીએ પોતાના શરીરના ડિમ્સની અંગ હાડકાની માવજત કરવી જોઈએ.

ગાંધીનગર, તા. ૨૦ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અલગ કુલ ૮ બાંચમાં તેઓનું વિમિટેડની રિઝાઓનલ ઓફિસ ઈન્ટરન્શીપ પ્લેસમેન્ટ કરવામાં સંલગ્ન હો. કોલેજ ઓફ બિઝિન્સ અને એટમિનિસ્ટ્રેશનના ૨૮ વિદ્યાર્થીઓનું કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે તાલીમ દરર્યાન બેન્કના એજલેયમ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ૩૦ દિવસ માટે શરીરમાં આવ્યું હતું. બીબીએ ને અવગાણીએ છી. હાડકાની અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શરીરમાં હાડકા પંચાવના સાઈટ વર્ષ પછી હાડકા મજબૂત રહે તે નબળા પડે તેના વિક્રી અલગ અલગ સ્વરૂપે દેખાય છે. જેમ કે ફેફાર, કરમાંથી બેવડ વળી જતું, છે. જેણી મ